



આઇ.સી.ડી.એસ. અર્બન પ્રોજેક્ટ

વડોદરા મહાનગરપાલિકા

www.vmc.gov.in icds@vmc.gov.in

-: ભરતી અંગેની જાહેર નિવેદા:-

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આઇ.સી.ડી.એસ. અર્બન પ્રોજેક્ટ હેઠળની મુખ્ય સેવિકા અને કો-ઓર્ડિનેટરની હંગામી જગ્યાઓ તથા આંગણવાડીઓમાં કાર્યકર/ તેડાગર (હેલ્પર) માટે ખાલી પડેલ/ પડનાર જગ્યાઓ માટે આંગણવાડી કેન્દ્રોના જ સ્થાનિક વિસ્તાર/ ફળીયાની પરણિત મહિલાઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે, ઓનલાઇન અરજીઓ જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૨૦ દિવસ સુધીમાં www.vmc.gov.in ઉપર કરવાની રહેશે.

જગ્યાનું નામ	લઘુત્તમ લાયકાત	પગાર ધોરણ	અંદાજિત જગ્યાઓ
પ્રોગ્રામ મેનેજર	અનુ સ્નાતક	રૂ. ૨૦,૦૦૦/-	૦૧
બ્લોક કો-ઓર્ડિનેટર	અનુ સ્નાતક	રૂ. ૧૫,૦૦૦/-	૦૨
મુખ્ય સેવિકા	સ્નાતક	રૂ. ૧૧,૫૦૦/-	૦૪
આં.વાડી. કાર્યકર	ધોરણ-૧૦	રૂ. ૬,૩૦૦/-	૩૨
આં.વાડી. તેડાગર	ધોરણ-૭	રૂ. ૩,૨૦૦/-	૪૩

ભરતી અંગેની તમામ માહિતીઓ જેવીકે લાયકાત, પગાર ધોરણ, આંગણવાડીઓની યાદી, ભરતીની શરતો, વગેરે વેબસાઇટ પરથી જ જોવા મળશે.

પી.આર.ઓ.નં. ૮૮૦ / ૨૦૧૭-૧૮

આરોગ્ય અમલદાર

જાહેરાતની તારીખ: ૦૫/૦૨/૨૦૧૮

સમાચાર પત્રક: ગુજરાત સમાચાર

અંતિમ તારીખ: ૨૪/૦૨/૨૦૧૮



આઇ.સી.ડી.એસ. અર્બન પ્રોજેક્ટ
વડોદરા મહાનગરપાલિકા

મુખ્ય સેવિકા અને કો-ઓર્ડિનેટરની ભરતી માટેની જાહેરાત
(પી.આર.ઓ. ક્રમાંક: ૮૮૦/ ૨૦૧૭-૧૮)

ક્રમ	જગ્યાનું નામ	લાયકાત	જગ્યાઓ	પગાર ધોરણ
૧	પ્રોગ્રામ મેનેજર	એમ.એસ.ડબલ્યુ / માસ્ટર ડીગ્રી ન્યુટ્રીશન/ માસ્ટર ગૃહ વિજ્ઞાન, કોમ્પ્યુટર/ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપર સંપૂર્ણ પ્રભુત્વ હોવું જરૂરી	૧	૨૦,૦૦૦/- ઉચ્ચક
૨	બ્લોક કો-ઓર્ડિનેટર	એમ.એસ.ડબલ્યુ / માસ્ટર ડીગ્રી ન્યુટ્રીશન/ માસ્ટર ગૃહ વિજ્ઞાન, કોમ્પ્યુટર/ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી	૨	૧૫,૦૦૦/- ઉચ્ચક
૩	મુખ્ય સેવિકા	ન્યુટ્રીશન, ગૃહ વિજ્ઞાન, સોસાયોલોજી પૈકી કોઈ પણ શાખાના સ્નાતક, કોમ્પ્યુટર/ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી	૦૪	૧૧,૫૦૦/- ઉચ્ચક

૧. લઘુતમ શૈક્ષણિક લાયકાત: ઉપર મુજબ

૨. અનુભવ: આઇ.સી.ડી.એસ.ની જેવી સેવાઓને લગતી કામગીરીનો ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ જરૂરી

૩. પગાર ધોરણ: ઉપર મુજબ ઉચ્ચક પગાર

૪. વય મર્યાદા: જાહેરાત પ્રસિધ્ધ થયાના રોજ જગ્યા ક્રમાંક ૧) ૪૦ અને જગ્યા ક્રમાંક ૨) થી ૩) ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

૫. નિમણૂકનો પ્રકાર:

૧) જગ્યા ક્રમાંક ૧ થી ૨: ૧૧ માસના કરારથી તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક પગારથી

૨) જગ્યા ક્રમાંક ૩: સરકારશ્રીમાંથી કાયમી જગ્યા ભરાય અથવા ૬ માસમાંથી જે ઓછું હોય તેટલા સમય માટે કરારથી તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક પગારથી

૬. પસંદગી પાત્ર: ઉમેદવાર નિયત લાયકાત ધરાવતા હોય તો તેમની પસંદગી થઈ જ જશે તેવું નથી, પસંદગીના તેમજ અન્ય તમામ અધિકારો પસંદગી સમિતિ પાસે અબાધિત રહેશે અને સમિતિનો નિર્ણય આખરી ગણાશે, તે અંગે વાંધો કે તકરાર કરી શકાશે નહીં.

જાહેરાતની સામાન્ય શરતો/ જોગવાઈઓ:

1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
2. રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાથી ૨૦ દિવસ દરમિયાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
3. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે.
4. ઉપરોક્ત યાદી પૈકી કોઇપણ એક જ જગ્યા માટે અરજી કરવાની રહેશે, એક થી વધુ જગ્યાઓ માટે અરજી કરી શકાશે નહીં, તેમજ આમ કર્યાનું ધ્યાને આવશે તો તમામ અરજીઓ રદ કરવામાં આવશે.
5. ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
6. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબક્કે રદ કરવામાં આવશે.
7. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકાના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
8. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/ લેખિત/ મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
9. આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/ અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
10. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

તા: ૦૫/ ૦૨/ ૨૦૧૮.

આરોગ્ય અમલદાર
વડોદરા મહાનગરપાલિકા